

B.Com. Semester - 6 (CBCS) Examination
May/June-2021 (OLD COURSE)
CORPORATE TAX PLANING -2(DSE-1)

Time: 1:30 Hours

Marks: 42

Instructions:

1. Figure to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

-
- પ્રશ્ન.૧ લિક્વિડેશનનાં સમયે મિલકતોનાં વિતરણનાં સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ ઉદાહરણ સાથે સમજાવો. (૧૪)
- પ્રશ્ન.૨ વૈજ્ઞાનિક સંશોધન મિલકતોનાં વેચાણનાં સંદર્ભ સાથે ઉદાહરણ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ સમજાવો. (૧૪)
- પ્રશ્ન.૩ સમજાવો: (૧) એડવાન્સ પ્રાઈસીંગ એગ્રીમેન્ટ. (૦૭)
 (૨) ડબલ ટેક્સેશન રિલિફ. (૦૭)
- પ્રશ્ન.૪ શાસક અને ગૌણ કંપનીઓ સાથે મિલકતોની ફેરબદલી વિશે સમજાવો. (૧૪)
- પ્રશ્ન.૫ નોંધ લખો. (કોઈ પણ બે) (૧૪)
 (A) કાયદા હેઠળ કામદારોનું મહેનતાણું.
 (B) કાયદા હેઠળ વૈજ્ઞાનિક સંશોધનની સમજૂતિ.
 (C) એડવાન્સ ડુલીઝ.
 (D) વિસર્જનનાં સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ.

ENGLISH VERSION

- Q.1 Explain Corporate Tax Planning with Reference to distribution of assets at the time of Liquidation with Example. (14)
- Q.2 Explain Corporate Tax Planning with Reference to Sale of Scientific Research assets with Example. (14)
- Q.3 Explain: (1) Advance Pricing Agreement. (07)
 (2) Double Taxation Relief. (07)
- Q.4 Explain about Transfer of assets between holding and subsidiary companies. (14)
- Q.5 Write notes (Any Two) (14)
 (A) Employees Remuneration under the Act.
 (B) Explanation of Scientific Research under the Act.
 (C) Advance Rulings.
 (D) Corporate Tax Planning with Reference of Demerger.
